



# જુનાગઢ કૃષિ યુનિવર્સિટી હસ્તકની પોલીટેકનીકમાં ખાલી રહેલ બેઠકોમાં પ્રવેશ માટેની જાહેરાત



જુનાગઢ કૃષિ યુનિવર્સિટી હસ્તકની પોલીટેકનીક ઇન એગ્રી એન્જિનિયરીંગ, તરઘડિયા (જિલ્લો : રાજકોટ) તથા પોલીટેકનીક ઇન એગ્રો-પ્રોસેસિંગ, જુનાગઢમાં ચાલતા ડિપ્લોમાં કક્ષાના અભ્યાસક્રમમાં પ્રવેશ પાત્રતા ધરાવતા ધોરણ ૧૦ માં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓ માટે વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ખાલી રહેલ સીટો માટે રૂબરૂ કાઉન્સેલિંગ દ્વારા તા. ૧૧-૦૧-૨૦૨૨ના રોજ સવારે ૧૦ કલાકે કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજ, જી.કૃ.યુ., જુનાગઢ ખાતે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ તમામ જરૂરી અસલ પ્રમાણપત્રો અને તેની બે નકલ સાથે આપેલ સમય અને તારીખ દરમિયાન હાજર રહેવું હાજર રહેવું.

**તારીખ:** તા. ૧૧-૦૧-૨૦૨૨

**સમય :** સવારના ૧૦.૦૦ કલાકે

**સ્થળ :** કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ

## એડમીશન માટે નીચેની સામાન્ય સુચનાઓ ધ્યાને લેવાની રહેશે

### ➤ પ્રવેશ લાયકાત

ઉમેદવારે ધોરણ ૧૦ની પરીક્ષામાં (૧) ગુજરાતી/પ્રાદેશિક ભાષા (૨) ગણિત (૩) વિજ્ઞાન (૪) સામાજિક વિજ્ઞાન /સમાજ વિદ્યા અને (૫) અંગ્રેજી વિષયના ગુણના નીચે દર્શાવ્યા પ્રમાણેના ટકા મેળવેલ હોવા જોઈએ.

**(૧) અનુસુચિત જાતિ (SC) તથા અનુસુચિત જન જાતિ (ST)ના ઉમેદવારો માટે ઓછામાં ઓછા ૩૩ ટકા**

**(૨) અન્ય ઉમેદવારો માટે ઓછામાં ઓછા ૪૦ ટકા**

➤ પ્રવેશ લાયકાત માટેના નીચેના ઓરીજનલ પ્રમાણપત્રો તથા તેની બે નકલ સ્વપ્રમાણિત કરીને સાથે રાખવાની રહેશે.

(૧) ધોરણ ૧૦ની માર્કશીટ

(૨) સ્કૂલ લિવિંગ સર્ટીફિકેટ

(૩) જાતિ / ઇ.ડબલ્યુ.એસ.નું સર્ટીફિકેટ (લાગુ પડતું હોય તો)

(૪) બક્ષીપંચના ઉમેદવારે નિયત સમયગાળાનું નોન-કિમિલેયર સર્ટીફિકેટ

(૫) પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ

➤ એડમીશન મળ્યે સ્થળ પર જ નિયત ફી (ભાઈઓ માટે રૂ. ૧૦૧૦/- તથા બહેનોએ રૂ. ૭૬૦/-) ભરવાની રહેશે.

➤ યુનિવર્સિટીના પ્રવર્તમાન એકેડેમિક રૂલ્સ મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોને તેમના **મેરીટના ધોરણે** પ્રવેશ આપવામાં આવશે.

➤ નિયત સમયથી મોડા આવેલ ઉમેદવારોને ઉક્ત પ્રવેશ પ્રક્રિયાને અંતે પણ જગ્યા ખાલી રહેશે તો જ પ્રવેશ આપવામાં આવશે.

➤ ઉમેદવારે સ્વ ખર્ચે એડમીશન માટે હાજર રહેવાનું રહેશે.

➤ ઉમેદવારે ગુજરાત સરકારશ્રીના COVID-19 અંગેના નિયમોનું પાલન કરવાનું રહેશે.

➤ હાલ ખાલી રહેલ સીટો ની માહિતી નીચે પ્રમાણે છે.

બંને પોલીટેકનીકમાં કેટેગરીવાઇઝ ખાલી રહેલ સીટોની વિગત

પોલીટેકનીકનું નામ	કુલ ખાલી સીટ	કેટેગરી					
		જનરલ	એસ.સી.	એસ.ટી.	એસ.ઇ.બી.સી.	ઇ.ડબલ્યુ.એસ.	અધર બોર્ડ
પોલીટેકનીક ઇન એગ્રી એન્જિનિયરીંગ, તરઘડિયા	૨૩	૬	૨	૩	૮	૨	૨
પોલીટેકનીક ઇન એગ્રો-પ્રોસેસીંગ, જુનાગઢ	૮	૨	૦	૩	૨	૦	૧

આચાર્ય અને ડીન  
કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય,  
જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ